



## નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ

પરિપત્ર નં. ૧૫૩ તા. ૬-૨-૧૫

ફક્ત મ્યુનિ. શાળાઓ માટે જ :-

**વિષય :- મેડિકલ વિકલ્પમાં ફેરફારની માહિતી મોકલી આપવા બાબત.**

આથી તમામ મ્યુનિ. શાળાઓને જણાવવાનું કે શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા પેન્શનરોને નાણાંકીય વર્ષની શરૂઆતમાં તથીબી સારવારના નિયમ ઉર્દુ.૫ મુજબ દર વર્ષ મેડિકલ વિકલ્પમાં ફેરફાર કરવાની તક આપવામાં આવે છે. આથી જે કર્મચારીઓ પગારમાં રૂ.૩૦૦/- ઉચ્ચક મેડિકલ એલા. મેળવવા માગે છે કે મેડિકલ રીએઝર્સ્મેન્ટની યોજનામાં જોડાવા માંગે છે તે અંગેની માહિતી નીચે જણાવેલ મુજબના પત્રકમાં તા.૨૮-૨-૧૫ સુધીમાં મેડિકલ કલાર્ક્શ્રીને રૂબરૂ હાથોછાથ મળે તે રીતે અચૂક મોકલાવી આપશો. નિયત તારીખ પછી આવેલ માહિતી રદ ગણાશે, વર્ષની શરૂઆતમાં સ્વીકારેલ વિકલ્પમાં અધવચ્ચેથી કોઈપણ સંજોગોમાં ફેરફાર કરી શકતો નથી. આ યોજનમાં કેન્સર, એઈડસ, ક્ષય અને ક્રીડની જેવા રોગોમાં સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવી વિકલ્પમાં ફેરફાર કરી આપવામાં આવશે. વિકલ્પમાં ફેરફાર કરવાનો હોય તે જ કર્મચારીઓની માહિતી અતે મોકલી આપવી એટલે કે જે શાળામાંથી કોઈપણ કર્મચારીને વિકલ્પમાં ફેરફાર કરવાનો ન હોય તેમણે માહિતી મોકલવાની જરૂર નથી. જે શાળામાંથી આચાર્યશ્રીનો રીપોર્ટ અતે નહીં આવે અને કર્મચારીને વિકલ્પમાં ફેરફાર કરવાનો રહી જશે તો તેની જવાબદારી આચાર્યશ્રીની રહેશે. આ પરિપત્ર શાળાના તમામ કર્મચારીઓને વંચાવી દરેકની સહી લઈ શાળા દફતરે રાખશો.

નમૂનો

મેડિકલ વિકલ્પમાં ફેરફારની માહિતી

શાળાનું નામ.....

ક્રમ	એમ્પલોઈ નંબર	કર્મચારીનું પૂરું નામ	હોદ્દો	મેડિકલ વિકલ્પમાં ફેરફારની વિગત	કર્મચારીની સહી
૧	૨	૩	૪	૫	૬

આચાર્યની સહી/ સિક્કા

તા. ૬-૨-૧૫

ડૉ. એલ. ડી. દેસાઈ

શાસનાધિકારી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અમદાવાદ